



Knowledge Consortium of Gujarat

Department of Higher Education - Government of Gujarat

Journal of Humanity

ISSN: 2279-0233

Year-1 | Issue-1 | April-May 2012

રાગ તરફથી ત્યાગ તરફની ગતિ : બિલ્વમંગલ

કોઇપણ કૃતિના આસ્વાદ-ભાવન માટે જે તે કવિના જીવનની માહિતી અનિવાર્ય બની રહે છે. કલાપી અને રાવજી પટેલ માટે તો ખાસ. આ બંને કવિના જીવનનો એમના કવન સાથે દઢ નાતો રહેલો છે. બંનેના સર્જનમાં જીવનની પ્રત્યેક ક્ષણની પ્રતીતિ અનુભવાય છે. એમની કવિના આસ્વાદમાં જીવનનો વિચ્છેદ વિધ્નરૂપ બની રહે છે.

કલાપીના હૃદયના રાગ અને વિરાગ બે સ્થાયીભાવ છે. આ બંને ભાવો એમના જીવનનું પ્રભાવક બળ હતા. જન્મ્યા ત્યારથી જ કલાપી મૃત્યુ ઓથાર નીચી જીવ્યા. તેમના માતાપિતાનું પણ રાજખટપટને કારણે જ થયું. પ્રવાસ જતાં પહેલાં તેમને પણ ઝેર આપવાનો પ્રયાસ થયો હતો. તેમના જન્મ વિશે પણ અનેક લોકવાયકાઓ પ્રચલિત છે. પોતે રાજબીજ નહીં પણ બાવાનું સંતાન છે એવો અધ્યાસ તેમનો હતો. પરિણામે કવિમાં વૈરાગ્યભાવ શૈશવથી કેળવાયો હતો. વળી, બે કુંવરીઓ સાથે લગ્ન અને કિશોર દાસી શોભના પ્રત્યેનો અનુરાગ કવિચિત્તમાં ધમસાણ મચાવી દે છે. રાગ અને ત્યાગની વચ્ચે ખેંચાતું રહેલું એમનું હૈયું કવિતામાં ધબકે છે.

“ માથિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો!

બન્યું રહે મસ્ત મસ્તાનું, મસ્તીનો તું લે લ્હાવો” (મસ્ત ઇશક)

માયાવી પ્રેમથી મુક્ત થવા પાછળના અનેક કારણોમાં કવિના જીવનની કેટલીક ઘટનાઓની સાથે અભ્યાસ અને અનુભવ મુખ્ય છે. વર્ડઝવર્થ એમના પ્રિય કવિ. તો મિત્ર કાન્તને લીધે સ્વીડનબોર્ગના અભ્યાસી બન્યા. જ્યારે મણિલાલ નભુભાઈ દિવેદી ગુરુ સમાન હતા. એમના સહવાસને લીધે શંકરાચાર્યના વેદાંતનું જ્ઞાન કલાપીને મળ્યું હોવાનું મનાય છે. એટલે જ અદ્વૈતવાદ, સૂફીવાદ અને વર્ડઝવર્થના સર્વાત્મવાદ (PANTHEISM) નો ત્રિવેણી સંગમ એમની કવિતામાં જોવા મળે છે.

આટલી પૂર્વભૂમિકા પછી કલાપીના 'બિલ્વમંગલ' કાવ્યને તપાસીએ તો અહીં સૂફીવાદની અસર જોઇ શકાય છે. સૂફીવાદ સમજ્યા સિવાય કલાપીને અનેકોએ અન્યાય કર્યો છે. આવા જ અન્યાયનો ભોગ દયારામ પણ બન્યા હતા. ઉઘાડા શૃંગારના કવિ હોવાનો આરોપ દયારામ પર લાગેલો, પણ ગોવર્ધનરામ 'દયારામનો અક્ષરદેહ' લખી એમની કવિતાનું રહસ્ય સમજાવ્યું. તેજ પ્રમાણે કલાપીની કવિતામાં માથુકના નામથી પ્રિયાપ્રેમ નહીં પરંતુ પ્રભુપ્રેમનું વર્ણન છે. જે સૂફીવાદની અસર છે. 'સુફી વિચારસરણી મુજબ ઇશ્વરી પ્રેમ 'ઇશક હકીકી' ની શરૂઆત પાર્થિવ માનવી પ્રેમ 'ઇશક મિજાજી' થી જ થઇ શકે. સૂફી મહાત્મા 'જામી' આ સિદ્ધાંતનું એક એક દષ્ટાંત આપતાં જણાવે છે કે કોઇ એક શિષ્ય એક સૂફી મહાત્મા પાસે દીક્ષા લેવા ગયો ત્યારે મહાત્માએ તેને કહ્યું કે તું કોઇ વ્યક્તિનો આશક થઇને આવ અને તારા ખરા પ્રેમથી તેને ચાહતા શીખ ત્યાર બાદ જ તને દીક્ષા આપી 'ઇશક હકીકી' ઇશ્વર પ્રેમ શું છે તે શીખવી શકાય. સૂફી એ ઇસ્લામનો અગમ્યવાદ છે. સૂફી શબ્દ 'સૂફ' એટલે ઉન પરથી નીકળ્યો છે. ઉનનો ડગલા પહેરી જે ઇસ્લામી સંતો પ્રભુની સાથે એકરૂપ થવાનો બોધ કરતા તેમને સૂફી નામ આપવામાં આવતું. સૂફીવાદમાં ફનાફી શયપ ફનાફી શેખડ ફનાફી રસુલુ અને ફનાફીલ્લાહ એમાં ચાર તબક્કા મનાય છે. જે કલાપીની કવિતામાં જુદા જુદા રૂપે-રંગે છે. જેમકે -

'હવે જોવા ચાલ્યું જિગર મુજબ સાક્ષાત હરિને' (ઉત્સુક હૃદય)

'હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા (હમારા રાહ)

'ફાની છે આ જગત સઘળું, અન્ત આ જીવવાને,

જે છે તે ના ટકી દઈ કહે સર્વદા કાલ કયાંયે,

શોધી લે ને પ્રિય સખે ! સર્વદા જે રહેશે,

આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દે ને ! (બિલ્વમંગલ)

કલાપીમાં રહેલ આ સૂફીવાદનો મર્મ સહૃદયોને જગન્નાથ દામોદર ત્રિપાઠી-સાગર મહારાજે સમજાવ્યો છે. એમણે ૧૯૦૭, ૦૮ અને ૦૯ માં 'કલાપી અને તેની કવિતા' વિશે એક સુદીર્ઘ વિવેચન લખ્યું. તેઓ ૧૯૧૦ માં બે વાર લાઠી ગયાં બીજી વાર ગયા ત્યારે કલાપીની

સમાધી આગળ તેમણે ગૃહસ્થી પહેરવેશ ત્યાગી સૂઝી અલ્ફી ધારણ કરીલ. તા. ૩૦/૧૧/૧૮૯૫ ના રોજ 'બિલ્વ મંગલ' છપાયું. તે વેળા કવિના મનમાં ચાલતી ગડમથલ રમાને સંબોધીને લખેલ પત્રમાં સ્પષ્ટ થાય છે. 'અરે મેં જે ધ્યાર તમારા પર રાખ્યો હતો તેટલો ઇશ્વર પર રાખ્યો હોત તો આજ તરી ગયો હોત તો હવે મારે આ જંજાળ, જેમાં હું ખોટો ગેરવિશ્વાસુ અને કદર વિનાનો ગણાયો, તે છોડી દઈ એક પરમાત્માની સાથે જ લગની રાખવી એ જેવું બીજું કંઈ જ ઉત્તમ નથી'૧૦. 'મહાત્મા મૂળદાસ' અને 'ગ્રામ્યમાતા' ની જેમ 'બિલ્વમંગલ'નું વસ્તુ પણ કલાપીએ લોકસાહિત્યમાંથી લીધું છે. મહાત્મા મૂળદાસની હકીકત અમરેલી પાસે બની હતી. આજેય એ જગ્યા હયાત છે. 'બિલ્વમંગલ' વિશે પણ એવું છે. એ નામનો એક વૈષ્ણવ ભક્ત કવિ ને પાછલા જીવનમાં સુરદાસ નામથી પ્રખ્યાત થયેલો છે. તે ઇ.સ.ચૌદમાં શતક પહેલા થઈ ગયેલ નક્કી થાય છે. ચિંતામણી નામની ગણિકાથી તે ભક્તિમાં પ્રેરાયો હતો'૧૧. 'બિલ્વમંગલ' સંવત ૮૬૫માં થયેલ એક આચાર્ય હોવાનું પણ મનાય છે.૧૨ એવી જ રીતે તુલસીદાસના જીવન સાથે પણ આ કાવ્યની કથા સંકળાયેલી છે. કલાપીએ આ કાવ્યનું પ્રથમ શીર્ષક 'તુલસી' રાખ્યું હતું. પછી કાન્તે 'બિલ્વમંગલ' કર્યું છે. એ જ શીર્ષકથી પછી એ છપાતું રહ્યું.

આ કાવ્યના સ્વરૂપ વિશે વિવિધ મતમતાંતરો છે. ખંડકાવ્યોના અભ્યાસુ ચિનુ મોદીના મતે 'આ રચના લોકરૂઢ ખ્યાતકથા પર આધારિત એ કથાકાવ્ય છે'૧૩ તો પ્રા.જયદેવ શુકલને 'બિલ્વમંગલ' ખંડકાવ્ય કરતાં કથાકાવ્યની વિશેષ નજીક પહોંચી જતું લાગે છે'૧૪ જ્યારે ડૉ. ઇન્દ્રવદન દેવે આરંભે આ કાવ્યને 'એક દીર્ઘ કથાકાવ્ય' કહે છે. પણ પછી તરત જ કાન્ત રીતિનું ખંડકાવ્ય રૂપે ઓળખાવે છે. ૧૫ કથાકાવ્ય અંગેની વિદ્વાનોની દલીલો સાથે સહમત થવું યોગ્ય છે.

૨૦૪ પંક્તિમાં વિસ્તાર પામેલા આ કાવ્યનું વસ્તુ જોઈએ તો આટલું જ છે. બિલ્વમંગલ શબ્દ પર સવાર થઈ બે કાંઠે જતી નદી ઓળંગી, લટકતા સાપને દોરડું સમજી તેનો સહારો લઈ ચિંતામણી સુધી પહોંચે છે. કામવશ બિલ્વમંગલના આંધળા પ્રેમની-સ્નેહની ચિંતામણીને સવારે ખબર પડે છે. આટલા પ્રેમને લાયક હું નહીં ઇશ્વર હોવાનું સૂચન - કાંતાસંમિત ઉપદેશ બિલ્વમંગલનું હૃદયપરિવર્તન કરી દે છે. તે 'સંસારીને શીખવીશ હવે સ્નેહ'વૈરાગ્ય' ભક્તિનો સંકલ્પ કરી નીકળી પડે છે. ચિંતામણીની આજીજી સાથે કાવ્ય પૂર્ણ થાય છે. કવિને આ કાવ્યના વસ્તુ કે કથાનકની પસંદગીમાં સફળતા મળી છે. એમાં ભાવ અને વૃત્તિના ઉછાળા લાવી શકાય એટલી શક્યતા છે. જે ઉત્કટતાથી બિલ્વમંગલ વાસના તૃપ્તિ તરફ આગળ વધે છે. એવી જ રીતે પાછો વળે છે. આખા કાવ્યમાં નાયકની ચિત્તવૃત્તિની ચહલપહલ સંઘર્ષની ક્ષણો ઊભી કરે એમ છે. પરંતુ તેનો લાભ કવિ લઈ શક્યા નથી. કાન્ત જેટલી સજ્જતા કલાપીમાં નથી, તે અહીં સ્પષ્ટ થાય છે.

કાવ્યના આરંભે સમય-સ્થળનો નિર્દેશ કરવા કવિએ પ્રકૃતિનો સહારો લીધો છે.

'છૂપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમઅંકે,
નિદ્રા મીઠી ગિરિ, નદી અને વિશ્વ આખુંય લે છે,
ને રૂપેરી શ્રમિત દિસતી વીજળી એક સ્થાને,
સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્ન માંહી દિસે છે.'

મેઘલી, અંધારી-તોફાની રાતે બિલ્વમંગલ પત્નીને મળવા નીકળી પડે છે. એનામાં જાગેલ કામવાસનાને વધુ પ્રત્યક્ષ કરવા કવિ નદીના પૂરને આલેખે છે. મેઘાચ્છાદિત આકાશ' મેઘગર્જના, વીજળીના ભડાકા અને કડાકા, ગર્જતી શ્યામ યમુના, શબ્દ અને સર્પ એ પ્રકૃતિના ભયાનક સ્વરૂપો છે. આવી ભયાનકતામાં પણ મસ્ત પ્રેમીને પ્રિયાદર્શનની તલપ છે.'

'તેની પત્ની હૃદયવિભુતિ સ્નેહની જે સરિતા,
તેની પાસે જિગર ઘસડી જાય છે લેઈ હાવાં,
આલેખાયું હૃદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,
અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહ્યું છે'.

પ્રિયાપ્રેમનું ખેંચાણ શબ્દ કે સર્પને કયાંથી જુએ ? 'પ્રેમ આંધળો છે'! એ અર્થમાં કહેવાતું હશે! પરંતુ સમયના પરિવર્તન સાથે જ કાવ્ય પણ પલટો લે છે. રાત્રીમાંથી પ્રભાતમાં, અંધકારથી પ્રકાશ તરફ, કામાંધતાથી જ્ઞાનપ્રકાશ તરફની ગતિ કવિ સૂચવે છે. સૂર્યોદય સાથે જ્ઞાનપ્રકાશનો ઉદય થાય છે. લાકડું માન્યું હતું તે શબ્દ અને દોરડું જેને માન્યું હતું તે સર્પ હતો તેનો ખ્યાલ આવે છે. પ્રેમીજનોના ચિંતનને વેગ આપવા કવિ દીવાનું પણ પ્રતીક પ્રયોજે છે.

'પેલો કામી પુરૂષ હજુ ત્યાં ગોખ માંહી ઊભો છે,
તેનો કામી પ્રણયી નયનો પ્રેમીને નીરખે છે,
ત્યાં દીવામાં ચડચડી મર્યું એક ભોળું પતંગ,

જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન’.

મૂક વિચારતી નાવિકા દીવાના પ્રસંગથી નિશ્ચિત થઇ, આ આસક્તિને ક્ષણભંગુર દેહ તરફથી શાશ્વત પરમાત્મા પ્રતિ વાળવા નાયકને પ્રેરે છે. તે પ્રિયતમને બોધ આપે છે.

‘મારા વ્હાલા ! સુર ! હૃદયથી દાસતું ઇશનો થા !’

** ** * * *

‘શું છે હું-માં ? સુખરૂપ તને દેહ આ ના થવાની’

આ પંક્તિઓ કલાપીના અસ્વસ્થ ચિત્તમાં વારંવાર ઉઠતા નિર્વેદ (વૈરાગ્ય) ની નિશાની છે. પ્રણય દ્વારા પણ ઇશ્વર પ્રાપ્તિની શક્યતા સૂફીવાદમાં શ્રદ્ધાળુ કલાપીને છે. સ્નેહ જ્યારે જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે. ત્યારે એનો અંત શાંત હોય છે. જે અહીં ફલિત થાય છે. કવિનું કાવ્યનું કાવ્યયોજન પણ સિદ્ધિ થાય છે.

‘ફાની છે આ જગત સઘળું.....’

બિલ્વમંગલનો માનસપલટો થાય છે. જો કે કવિએ ધીરજ ગુમાવી છે. કવિની આ મર્યાદા અંગે ચિનુ મોદી નોંધ્યું છે કે ‘અપ્રતીતિકર અભિવ્યક્તિને કારણે ‘બિલ્વમંગલનું’ પોત ઘણું ફિસ્સુ લાગે છે. ચરિત્રચિત્રણ સાવ પાંખું લાગે છે. આ રચનામાં બિલ્વમંગલ નહીં પણ કલાપી જ નાયક બને છે. અને ચિંતામણીને પણ મુખવાદ જ બનાવે છે. આથી, આ બેમાંથી એકકેયનું ચરિત્ર સુરેખ, જીવંત અને એથી કલામય બની શક્યુ નથી. બેઉનાં ઉચ્ચ કવિ દ્વારા હૃદયવલોવણ સંઘર્ષણોની જે શક્યતાઓ હતી તેનો લાભ કલાપી લઈ શક્યા નથી અને એથી વસ્તુગત બાહ્ય સંઘર્ષને કલાપી પાત્રમાં સંક્રાંત કરી શક્યા નથી. ૧૬ કવિનો વર્ણનશોભ અને ઉપદેશશોભ પણ કાવ્યને હાની પહોંચાડે છે. વૃત્તવૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો અહીં કવિએ ૫૧માંથી ૪૯ શ્લોકોમાં મંદાકાન્તાનો વિનિયોગ કર્યો છે. ૫૦-મા શ્લોકમાં અનુષ્ટુપ અને ૫૨-મા શ્લોકમાં દ્રુતવિલિંબિતનો પ્રયોગ છે.

ટૂંકમાં ‘ઇશ્કે મિજાજી’ માંથી ‘ઇશ્કે હકીકી’ –પ્રિયા પ્રેમમાંથી પ્રભુપ્રેમમાં થયેલું એક ‘મસ્ત પ્રેમી’ના પ્રેમનું પરિવર્તન એ આ કાવ્યનો વિષય છે. પ્રેયસીની એક ટકોર નાયકનું હૃદયપરિવર્તન કરી નાખે છે. કાંતાસંમતિ ઉપદેશ એક રાગીને વિરાગી બનાવી દે છે. ગગનવિહારી મહેતાએ જરા જુદી રીતે કાન્તાના ‘વસંતવિજય’ સાથે આ રચનાની સરખામણી કરી છે. અહીં કામી પ્રેમીનું વિરાગી ભકતમાં રૂપાંતર થાય છે. જ્યારે કાન્તાના ‘વસંતવિજય’માં એક વિરાગીનું રાગીમાં પરિવર્તન થાય છે. બાહ્ય બળની મદદથી બિલ્વમંગલ આંતરિક બળ મેળવે છે, જ્યારે પાંડુને તે મળી શકતું નથી. તેના માટે તો બાહ્ય બળ કામોદ્રીપકતાનું સાધન બને છે. પાંડુને ત્યાગ તરફ જવું છે, પણ રાગમાં લપસી પડે છે. બિલ્વમંગલને રાગ તરફ જવું છે. પણ આંખ ઉઘડી જતાં ત્યાગ જ તેનો નિર્ધાર બને છે. એકના પતનની કથા છે. બીજાના ઉધ્ધારની કથા છે. ૧૭

આમ, કામી પ્રેમીનું જ્ઞાનીમાં રૂપાંતર એ આ કાવ્યનો મુખ્ય વિષય છે. લૌકિકને બદલે કવિની અલૌકિક સનમની શોધ અહીં આરંભાઈ છે. આ પ્રભુ સનમની ખોજ જ એમની પાસે લખાવે છે.

‘પેદા થયો છું ફૂંઢવા તુંને સનમ

ઉમ્મર ગુજારી ફૂંઢતાં તુંને સનમ’

પાદટીપ

1. કલાપીનો મણિલાલ નભુભાઈ દિવેદીને પત્ર તા. ૨૩/૧૨/૧૯૯૨
2. એજન
3. ઊર્મિમૂર્તિ કલાપી : બ.ક.ઠાકોર, અપ્રગટ વ્યાખ્યાનો, ગુજરાતી, ૧૦/૨/૧૯૩૫
4. ઇસ્લામનું રહસ્ય : સૂફીવાદ, લે. ચંકલાલ ઉ. મહેતા, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ. પ્રા. આ. - ૨૦૦૬, પૃ. ૨૬
5. એક વસ્તુમાં પોતાની યાદને ભૂલી જવું.
6. ગુરૂમાં જાત ભૂલવી.
7. મહમ્મદ પયગંબરબર સાહેબમાં પોતાનું અસ્તિત્વ ડૂબાવી દેવું.
8. ઇશ્વરમાં ભળી જવું.
9. ‘કલાપી શોધ અને સમાલોચન’, લે. રમેશ શુક્લ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ પ્ર, આ. ૨૦૦૨ પૃ. ૫૯-૬૦

10. રમાને પત્ર - ૧૦/૭/૧૮૯૦
11. 'ભગવદ્ગોમંડલ'-પ્રવીણ પ્રકાશન રજકોટ દિ.આ.૨૦૦૭,ભાગ-૭,પૃ.૬૩૮૩
12. એજન
13. 'ખંડકાવ્ય:સ્વરૂપ અને વિકાસ'-લે.ચિનુ મોદી, પાર્શ્વ પ્રકાશન ,અમદાવાદ પ્ર,આ.૨૦૦૧, પૃ.૨૨૭
14. 'ખંડકાવ્ય', લે.પ્રા.જયદેવ શુક્લ,ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ પ્ર,આ.૧૯૮૬ પૃ.૩૦
15. 'કલાપી'-એક અધ્યયન,લે.ડો.ઇન્દ્રવદન કા.દવે,ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ પુનર્મુદ્રણ-૧૯૮૦, પૃ.૩૬૩
16. 'ખંડકાવ્ય:સ્વરૂપ અને વિકાસ' -લે.ચિનુ મોદી, પાર્શ્વપ્રકાશન ,અમદાવાદ, પ્ર.આ.૨૦૦૧, પૃ.૨૨૬
17. 'કૌમુદી'ત્રૈમાસિકનો'કલાપી'અંક, લે.ગગનવિહારી મહેતા

ડૉ.એ.એ.શેખ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ

વાંસદા.જિ.નવસારી